

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૧૮

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● **LIKE US ON FACEBOOK** ●

HOME | કુરઆને મજીદ (પારા-૧૮) -1 | **VISIT US**

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૨૩	સૂર-એ-મોઅમેનુન (આયત ૧ થી ૧૧૮)	૪
૨૪	સૂર-એ-નૂર (આયત ૧ થી ૬૪)	૫૭
૨૫	સૂર-એ-કુરકાન (આયત ૧ થી ૨૦)	૧૧૩

سورة المؤمنون / સૂરચે મોઅમેનુન

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ ①

(૧) બેશક તે મોઅમીનો સફળ થઇ ગયા :

الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خٰشِعُونَ ②

(૨) કે જેઓ પોતાની નમાઝોમાં કરગરે છે :

وَالَّذِينَ هُمْ عَنِ اللّٰغُو مُعْرِضُونَ ③

(૩) અને જેઓ નકામી વાતોથી દૂર રહે છે.

وَالَّذِينَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُونَ ④

(૪) અને જેઓ ઝકાત અદા કરતા રહે છે :

وَالَّذِينَ هُمْ لِأُزْوَاجِهِمْ حَافِظُونَ ﴿٥﴾

(૫) અને જેઓ પોતાના ગુપ્ત ભાગોનું રક્ષણ કરે છે.

إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ
مَلُومِينَ ﴿٦﴾

(૬) સિવાય પોતાની પત્નીઓથી અથવા પોતાના હાથે મેળવેલી (કનીઓ)ઓથી, તો તેઓ નિસંશય ઠપકાને પાત્ર નથી.

فَمَنْ ابْتَغَىٰ وَرَاءَ ذَلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعُدُونَ ﴿٧﴾

(9) પછી જે કોઈ તે સિવાયની ખ્વાહીશ (ઈચ્છા) કરે તો તેઓજ અત્યાચારી છે.

وَالَّذِينَ هُمْ لِأْمْنَتِهِمْ وَعَهْدِهِمْ رِعُونَ ﴿٨﴾

(૮) અને તેઓ (પણ સફળ થઈ ગયા) કે જેઓ પોતાની અમાનતોનું તથા વચન વાચદાનું પાલન કરે છે.

وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ ﴿٩﴾

(૯) અને જેઓ પોતાની નમાઓની કાળજી રાખે છે.

أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ ﴿١٠﴾

(૧૦) એજ લોકો તો (ખરા) વારસ છે :

الَّذِينَ يَرْتُؤْنَ الْفِرْدَوْسَ ط هُمْ فِيهَا خَالِدُونَ ۝۱۱

(૧૧) જેઓ જન્નતુલ ફિરદોસને વારસામાં લઈ લેશે; જેમાં તેઓ હંમેશ માટે રહેનારા હશે.

وَلَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ مِنْ سُلَالَةٍ مِّنْ طِينٍ ۝۱۲

(૧૨) અને ખરેખર અમોએ માણસને માટીના સત્વમાંથી પેદા કર્યો છે.

ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَّكِينٍ ۝۱۳

(૧૩) પછી અમોએ તેને સુરક્ષિત (ગર્ભ) સ્થાનમાં વીર્યબિંદુ બનાવી મૂક્યું.

ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا
 الْمُضْغَةَ عِظًا فَكَسَوْنَا الْعِظَ لَحْمًا ۖ ثُمَّ أَنْشَأْنَاهُ خَلْقًا
 آخَرَ ۖ فَتَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ ﴿١٣﴾

(૧૪) પછી અમોએ તે વીર્યના ટીપાને બાઝી
 ગએલા લોહીનો ગોળો બનાવ્યો, પછી તે બાઝી
 ગએલા લોહીને અમોએ માંસનો લોચો બનાવ્યો,
 પછી તે માંસના લોચામાં હાડકાં બનાવ્યા, પછી તે
 હાડકાં પર અમોએ માંસનું આવરણ ચઢાવ્યું, તે
 બાદ અમોએ (તેમાં રૂહ નાખી) તેની એક બીજી જ
 આકૃતિ (સર્જત) બનાવી; તો કેવો બરકતવાળો છે
 તે અલ્લાહ કે જે સર્વોત્તમ સર્જનહાર છે !

ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذَلِكَ لَمَيْتُونَ ﴿١٥﴾

(૧૫) પછી તે બાદ તમે સઘળા ખરેખર મરવાના છો.

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ ﴿١٦﴾

(૧૬) પછી કયામતના દિવસે તમે પાછા (કબરોમાંથી) ઉઠાડવામાં આવશો.

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَائِقَ ۗ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ

غَفْلِينَ ﴿١٧﴾

(૧૭) અને ખરેખર અમોએ તમારા પર સાત આસમાનો બનાવ્યા છે; અને અમે સૃષ્ટિ (સર્જન)થી અજ્ઞાત ન જ હતા.

وَأَنْزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَسْكَنَتْهُ فِي الْأَرْضِ ۗ وَإِنَّا

عَلَىٰ ذَهَابٍ بِهٖ لَقَدِيرُونَ ﴿١٨﴾

(૧૮) અમોએ આસમાનમાંથી જોઇતા પ્રમાણમાં પાણી ઉતાર્યું, પછી તેને ભૂમિમાં થંભાવી દીધું, અને નિસંશય અમે તેને લઇ જવા (વહાવી દેવા) ઉપર પણ કાબૂ ધરાવીએ છીએ.

فَأَنْشَأْنَا لَكُمْ بِهِ جَنَّاتٍ مِّنْ نُجُيْلٍ وَأَعْنَابٍ لَّكُمْ فِيهَا

فَوَاكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ ﴿١٩﴾

(૧૯) પછી અમોએ તે વડેજ તમારા માટે ખજૂરો (તથા) દ્રાક્ષના બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે (જાત જાતના) ઘણાં મેવા (ઉત્પન્ન થાય) છે,

અને તેમાંથી જ તમે (કેટલાક મેવા) ખાઓ પણ
છો:

وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُورِ سَيْنَاءَ تَنْبُتُ بِالذُّهْنِ وَصَبْغٍ
لِّلْأَكْلِيِّينَ ﴿٢٠﴾

(૨૦) અને એક ઝાડ કે જે સીના (નામક) પહાડમાં
ઉગે છે, તે એક (જાતનું) તેલ લઈને ઉગે છે, અને
ખાનારાઓ માટે તરકારી પણ.

وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُسْقِيكُمْ مِمَّا فِي بُطُونِهَا وَلَكُمْ
فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ ﴿٢١﴾

(૨૧) અને નિસંશય ચોપગાંઓમાં પણ તમારા
માટે એક બોધપાઠ છે; જે કાંઈ તેમના પેટમાં છે

તેમાંથી અમે તમને (દૂધ) પાઇએ છીએ અને તેમાં તમારા માટે (બીજા પણ) ઘણા લાભ છે, અને તેમાંથી જ કેટલાકો (નું માંસ) પણ તમે ખાઓ છો:

وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ ﴿٢٢﴾

(૨૨) અને તેમના પર તથા વહાણો પર તમે સવાર થઇ ફરો છો.

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يٰقَوْمِ اعْبُدُوا اللَّهَ مَا

لَكُمْ مِنْ إِلَهِ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ ﴿٢٣﴾

(૨૩) અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ (રસૂલ બનાવી) મોકલ્યો હતો, પછી તેણે (પોતાની કોમને) કહ્યું કે અય મારી કોમ ! તમે અલ્લાહની

ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઇ
માઅબૂદ નથી; તો શું તમે (તેના અઝાબથી) ભય
નથી પામતા ?

فَقَالَ الْمَلَكُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ مَا هَذَا إِلَّا بَشَرٌ
مِّثْلُكُمْ ۗ يُرِيدُ أَنْ يَتَفَضَّلَ عَلَيْكُمْ ط وَلَوْ شَاءَ اللَّهُ لَأَنْزَلَ
مَلَائِكَةً ۗ مَا سَمِعْنَا بِهَذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ ﴿٢٣﴾

(૨૪) ત્યારે તેની કોમમાંથી જેઓ ઇમાન લાવ્યા ન
હતા તેમના સરદારોએ કહ્યું કે આ (નૂહ) કાંઈજ
નથી પણ તમારા જેવો એક માનવી છે, જે (એવું)
ચાહે છે કે તમારા પર તે શ્રેષ્ઠતા ભોગવે; અને જો
અલ્લાહ ચાહતે તો (તેના બદલામાં) ખરેખર

ફરિશ્તો ઉતારતે. અમોએ તો અમારા આગલા બાપદાદાઓ (ના સમય)માં પણ આવી વાત સાંભળી નથી.

إِنَّ هُوَ إِلَّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَاَتَرَبَّصُوا بِهِ حَتَّىٰ حِينٍ ﴿٢٥﴾

(૨૫) આ કાંઈજ નથી પણ એક (સામાન્ય) માનવી કે જેને ગાંડપણ થઈ ગયું છે, માટે તમે તેના સંબંધમાં થોડો વખત રાહ જુઓ.

قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ ﴿٢٦﴾

(૨૬) (આથી નૂહે) અરજ કરી કે અય મારા પરવરદિગાર! તેમણે મને જૂઠલાવ્યો છે, માટે તું મારી મદદ કર.

